



September 08, 2023

To,
The Department of Corporate Services,
BSE Limited, Mumbai

To,
The Listing Compliance Dept.
National Stock Exchange of India Ltd, Mumbai

BSE Script Code: 531795

NSE Script Symbol: ATULAUTO

SUB : NEWSPAPER NOTICE U/R 30 OF THE SEBI (LODR) REGULATIONS, 2015
REF : NOTICE OF 35TH ANNUAL GENERAL MEETING (AGM)

With respect to above subject, this is to inform the stock exchanges that pursuant to the provisions of sections 91 and 108 of the Companies Act, 2013 with the Companies (Management and Administration) Rules, 2014 and Regulations 47 of SEBI (LODR) Regulations 2015, the Company has given the Notice of 35th Annual General Meeting of the Company which is scheduled to be held on September 30, 2023 at 01.00 pm (IST) through Video Conferencing/ Other Audio Visual Means without physical presence of the members at a common venue with e-Voting details and Book Closure for the purpose of AGM.

An advertisement to this effect has been published in Indian Express (English) and Financial Express (Gujarati) newspaper for the information of members. A copies of newspaper advertisement are attached herewith.

Please take the same on your record.

Yours faithfully,
For Atul Auto Limited,

(Paras J Viramgama)
Company Secretary & Compliance Officer

ATUL AUTO LIMITED

(Corporate Identification Number: L54100GJ1986PLC016999)

Regd. Office & Factory: National Highway 8-B, Near Microwave Tower, Shapar (Veraval), Rajkot – 360024 (Gujarat)

Phone: 02827 235500 **Website:** www.atulauto.co.in **E-Mail:** info@atulauto.co.in

RajCOMP Info Services Limited (RISL)

C-Block, 1st Floor, Yojana Bhawan, Tikla Marg, C-Scheme, Jalpur.

RISL invites bids from the eligible bidders for the following:

NIS No./Date/Unique bid no.	Particulars	Estimated Cost/EMD	Start of sale/Last date
709/01.09.2023 (RIS/23/4WS0)	Request for Proposal (RFP) for establishment of incubation & Innovation Centre at Govind Guru Tribal University, Banswara, Jalore	Rs.2.40 Cr Rs.4.40	05.09.2023 26.09.2023

Details can be seen on the websites <http://nsl.rajsanjan.gov.in>, <http://sopn.rajsanjan.gov.in>, <http://doic.rajsanjan.gov.in>. Bids are to be submitted through <http://eproc.rajsanjan.gov.in>.
Raj.Samwadi/C23/8787
Chief Engineer, IT&C

ATUL AUTO LIMITED

(CIN: L54100GJ1986PLC016999)
Regd. Office : Survey No. 86, Plot No. 1-4, 8B National Highway, Near Microwave Tower, Shapur (Veraval), Dist. Rajkot, Guj., INDIA 360024
Phone: 02827 235500 E-Mail: investorrelations@atulauto.co.in

NOTICE OF 35TH ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE, INFORMATION REGARDING E-VOTING

Notice is hereby given that the Thirty Fifth Annual General Meeting ("AGM") of the Company is scheduled to be held on Saturday, September 30, 2023 at 01:00 pm (IST) through Video Conferencing (VC) / Other Audio Visual Means ("OAVM") without physical presence of the members at a common venue, in compliance with the provisions of the Companies Act, 2013 and in accordance with circulars dated April 08, 2020, April 13, 2020, May 05, 2020, January 13, 2021, December 28, 2022 as issued by Ministry of Corporate Affairs ("MCA") and circular dated May 12, 2020 and January 05, 2023, issued by the Securities and Exchange Board of India (collectively referred to as "Circulars").

In accordance with the aforesaid Circulars, Notice of the AGM along with the Annual Report 2022-23 is being sent by electronic mode to those Members whose e-mail addresses are registered with the Company/Depositories. The dispatch of Notice of AGM along with Annual Report through e-mail has been completed on September 06, 2023. These documents are also available on the Company's website www.atulauto.co.in and on the website of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited as well as on the website of www.nseindia.com and www.evoting.nsdl.com

In compliance with provisions of section 108 of the Act read with rules made thereunder, as amended from time to time and Regulation 44 of the SEBI (LODR) Regulations, 2015, the Company is providing e-voting facility (remote e-voting and e-voting during AGM) to members to cast their vote electronically through electronic voting system of NSDL. All members are informed that:

- All the businesses as stated in the Notice of 35th AGM may be transacted through voting by electronic means;
- The remote e-voting shall commence at 09:00 AM (IST) on September 27, 2023 and will end at 5:00 PM (IST) on September 29, 2023. The remote e-voting shall not be allowed beyond the said date and time.
- The cut-off date for determining the eligibility to vote by electronic means or to attend AGM is September 23, 2023.

4. In case a person has become a member of the Company after dispatch of AGM Notice, but on or before the cut-off date i.e. September 23, 2023, such person may obtain the User ID and Password for e-voting from NSDL by sending an e-mail request on evoting@nsdl.co.in or call at 022-48867000 or 022-24997000 and may cast the vote by following the instructions and process of e-voting as provided in the Notice of AGM and on website of NSDL i.e. www.evoting.nsdl.com

5. In case of any queries relating to e-voting, members/ beneficial owners may refer the Frequently Asked Question (FAQs) and e-voting user manual available for them at the download section of www.evoting.nsdl.com or call at the above mentioned phone number or send request to Mr. Ketankumar Patel, Assistant Manager, NSDL at evoting@nsdl.co.in or the undersigned on the above mentioned contact details who is responsible to address the grievances connected with facility for voting by electronic means.

- The members may note that:
 - Once the e-vote on the resolution is cast by the members, they shall not be allowed to change it subsequently.
 - The facility for e-voting during AGM is made available for the members who have not cast their vote by remote e-voting.
 - The members who have cast their vote by remote e-voting may also attend the AGM through VC/ OAVM but shall not be entitled to cast their vote again and;
 - The person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut off date only shall be entitled to avail the facility of remote e-voting as well as e-voting during AGM;

The members who have not registered their e-mail address with the Company or Depository are requested to register it by following the procedure as mentioned in the Notice of AGM. The manner of remote e-voting and e-voting during AGM for the members who hold shares in physical mode or demat mode or those who have not registered their e-mail addresses with the Company/ Depository Participant are provided in the Notice of AGM.

Pursuant to section 91 of the Act read with rules made there under and regulation 42 of the SEBI (LODR) Regulations, 2015, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from September 24, 2023 to September 30, 2023 (both days inclusive) for the purpose of AGM.

For, ATUL AUTO LIMITED
(Paras J Viramgama)
Company Secretary & Compliance Officer
Place : Shapur (Dist. Rajkot)
Date : 06-09-2023

KIFS FINANCIAL SERVICES LIMITED

Registered Office: 4th Floor, KIFS Corporate House (Khandwala House), Nr. Land Mark Hotel, Nr. Neptune House, Iskon-Ambli Road, Bodakdev, Ahmedabad - 380054, Gujarat, India.
Contact: +91 79 69240000 - 09; CIN: L67990GJ1995PLC025234;
E-mail: cs@kifs.co.in; Website: www.kifsfinance.com

NOTICE OF 28TH ANNUAL GENERAL MEETING, VC/OAVM, BOOK CLOSURE, RECORD DATE & E-VOTING

Notice is hereby given that the 28th Annual General Meeting (AGM) of the members of the company is scheduled to be held on Friday, September 29, 2023 at 4:00 pm IST through video conferencing (VC) or other audio visual means (OAVM) in accordance with applicable provisions of the Companies Act, 2013 and in compliance with the procedure prescribed in general circular nos. 14/2020, 17/2020, 20/2020, 02/2021, 21/2021 and 10/2022 dated April 8, 2020, April 13, 2020, May 5, 2020, January 13, 2021, December 14, 2021 and December 28, 2022 respectively, issued by the MCA and circulars dated May 12, 2020, January 15, 2021 and January 5, 2023 issued by the SEBI, without physical presence of the members at a common venue.

The company has sent on Wednesday, September 6, 2023, the annual report along with notice convening 28th AGM, through electronic mode to all the members whose e-mail IDs are registered with the company / RTA / depository participant(s).

The annual report alongwith the notice convening the AGM is also available on the website of the company at www.kifsfinance.com and stock exchange at www.bseindia.com and website of NSDL at www.evoting.nsdl.com.

The remote e-voting period commences on Tuesday, September 26, 2023 at 9:00 am IST and will end on Thursday, September 28, 2023 at 5:00 pm IST. During this period and during AGM, the members may cast their vote electronically. The remote e-voting module shall be disabled by NSDL thereafter.

The manner of remote e-voting and voting at the AGM by members holding shares in dematerialized mode, physical mode and for members who have not registered their email addresses is provided in the notice of the 28th AGM and they can provide their mandate for receiving dividends directly in their bank accounts through ECS by following the instructions that are given in the AGM notice.

The members who have acquired shares after sending e-mail of notice may refer instructions for e-voting given in the notice of AGM for exercising their votes through remote e-voting and attending AGM through VC. The members who vote through remote e-voting may attend the AGM but shall not be allowed to vote again.

In case member(s) have not registered their e-mail addresses with the company / depository, please follow the below instructions to register e-mail address for obtaining annual report and login details for e-voting:

(1) For physical holding	To send a signed request letter mentioning the name and address of the member, mobile number, e-mail ID, self-attested copy of the PAN card, and self-attested copy of any document (eg.: driving license, election identity card, passport) in support of the address of the member via e-mail to cs@kifs.co.in & ahmedabad@linkintime.co.in
(2) For demat holding	Preferably register the same with your depository participant OR send above documents + DP ID & Client ID, self-attested client master or consolidated account statement via e-mail to cs@kifs.co.in & ahmedabad@linkintime.co.in

Members may send an e-mail request to evoting@nsdl.co.in for obtaining user ID and password by proving the details mentioned in point (1) or (2) as the case may be, to receive login ID and password for e-voting.

Pursuant to the applicable provisions, payment of final dividend, if declared at the ensuing AGM and the facility of remote e-voting and participation at AGM through VC shall only be made available to those members whose names appear in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date i.e. Friday, September 22, 2023. For e-voting, AGM and payment of final dividend, the register of members and share transfer books shall remain closed from Saturday, September 23, 2023 to Friday, September 29, 2023 (both days inclusive).

Members who need assistance for e-voting before or during the AGM can contact NSDL on evoting@nsdl.co.in / 1800-222-990 or contact Mr. Amit Vishal, senior manager - NSDL at amitv@nsdl.co.in / 022-24994360 / +91 9920264780 or Mr. Sagar Ghosalkar, assistant manager - NSDL at sagar.ghosalkar@nsdl.co.in / 022-24994553 / +91 9326781467.

For KIFS Financial Services Limited, Rajesh P. Khandwala, Managing Director, DIN: 00477673, Ahmedabad, September 7, 2023

GUJARAT MARITIME BOARD

Sagar Bhavan, Opp. Airforce Station, Sector-10/A, Gandhinagar-382 010. Ph. No: (079) 23238346-47

ONLINE TENDER NOTICE No.-08 of 2023-24

On behalf of Chairman - Gujarat Maritime Board, Executive Engineer (Civil) Construction Division, Nr. ST bus stand, Chowpatti road, GMB, Porbandar, Dist. Porbandar invites on-line tenders in two cover bid for the following work.

- Construction of approximate 200m Jetty and Approach at Okha Port. Part-I: Construction of RCC Jetty. Part-II: Development of Backup area with shore protection work. Part-III: Dredging by suitable Type Dredging equipment at Proposed ICG area at Okha Port.(2nd attempt)

The bid documents will be available from 05/09/2023 to 26/09/2023 upto to 18.00 Hrs. on website www.nprocure.com & www.gmbports.org

WESTERN RAILWAY

PROVIDING RCC BOX AT VARIOUS LOCATIONS

Divisional Railway Manager (WA), Western Railway, 6th floor, Engg. Deptt., Mumbai Central, Mumbai - 400 008. invites **Tender Notice No. : BCT/23-24/172 dttd.05.09.2023.** Work and location: Joravarsur-Surat Section Providing RCC Box in lieu of Masonry arch bridge at various location under DEN/Central (Composite Tender) (Two Pocket System). Approx. cost of work Rs. 21,63,46,599.92/-, EMD Rs. 123,17,00,000. Date & Time of Submission : on 06.10.2023 till 15.00 hrs. Date & Time of opening: on 06.10.2023 at 15.30 hrs. Regarding detailed nature of work, containing cost of tender document (non refundable), EMD, eligibility criteria, similar nature of work, detailed tender conditions, please visit www.ireps.gov.in. Manual offers will not be considered. 0597

Like us on : [Facebook.com/WesternRly](https://www.facebook.com/WesternRly)

Leadership and beyond

THE NEW INDIA ASSURANCE CO. LTD.

(A Government of India Undertaking)
CIN : L 66000 MH 1919 GOI 000 526 | <http://newindia.co.in>

Regional Office : 9th floor, Suraj Plaza-2, Sayajigunj, Vadodara - 390020. Ph. No. : 0265 2363004/6 | Email : nia.220000@newindia.co.in

The New India Assurance Co.Ltd. Intends to acquire commercial premises for our Business Office having carpet area of approx 1400 sq.ft. (Subject to Actual Measurement as per IS: 3861 of 2002) Located at Santram Road / College Road / Pellad Road and Pij Road of Nadiad on lease basis. Interested owners may visit Company's website at www.newindia.co.in for more details. Last date for Submission of bids is 03/10/2023 upto 17.00 Hours.

TRIBAL COOPERATIVE MARKETING DEVELOPMENT FEDERATION OF INDIA LIMITED (TRIFED)

(MINISTRY OF TRIBAL AFFAIRS, GOVERNMENT OF INDIA)
HEAD OFFICE: NSIC Business Park, NSIC Estate, Okhla Phase-III, Okhla Industrial Area, New Delhi-110022

Advertisement No. : 06/2023

Inviting applications from Retired Personnel of Central/ State Government Ministries/ Departments/Autonomous / Statutory bodies/ PSUs retired from level 6 to level 10 of 7th CPC and equivalent for engagement of 10 Consultants.

TRIFED (An organization under the Ministry of Tribal Affairs, Govt) proposes to engage 10 Consultants with experience in Personnel/ Audit / Finance/ HR/ Projects etc. from amongst retired personnel of Central/ State Government Ministries/ Departments/ Autonomous/ Statutory bodies/ PSUs on contract basis. The last date of receipt of application is 25.09.2023.

For further details, applicants may visit TRIFED's website <http://www.trifed.org> under opportunities - careers section or contact the Personnel Division, TRIFED, Head Office, New Delhi at 011-20683014/15/16. davp.434011/12/0016/2324 General Manager (Personnel)

"IMPORTANT"

Whistler care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals making necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.

Arman Financial Services Limited

Regd. Office: 502-503, Sakar III, Opp. Old High Court, Off Ashram Road, Ahmedabad 380014.
Ph.: 079-40507000, 27541989 CIN: L55910GJ1992PLC018623
Email: finance@armanindia.com, Website: www.armanindia.com

NOTICE OF THE 31ST ANNUAL GENERAL MEETING AND INFORMATION ABOUT E-VOTING

NOTICE is hereby given that the 31st (Thirty First) Annual General Meeting (AGM) of the members of the Company will be held on Friday, September 29, 2023 at 12:00 noon through Video Conferencing ("VC") or Other Audio Visual Means ("OAVM"), to transact the business as set out in the Notice of AGM in accordance with the applicable provisions of the Companies Act, 2013 ("Act") and Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations, 2015) and in compliance with the procedure prescribed by various circulars issued by MCA and Securities and Exchange Board of India from time to time.

Notice is also hereby given pursuant to Section 91 of the Act and Regulation 42 of the SEBI Listing Regulations, 2015 that the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Saturday, September 23, 2023 to Friday, September 29, 2023 (both days inclusive) for the purpose of Annual General Meeting of the Company for the FY 2022-23.

The Annual Report including the Notice of AGM which includes the process and manner of attending the AGM through VC / OAVM and e-voting and other documents has been e-mailed on September 6, 2023 to those members whose email addresses are registered with the Company / Depositories. The Annual Report can be downloaded from the web-links: <https://www.armanindia.com> or <https://www.evoting.nsdl.com>.

The Company is pleased to provide its members the facility of casting votes electronically ("remote e-voting"), through the e-voting services provided by National Securities Depository Limited ("NSDL").

The remote e-voting period begins on Tuesday, September 26, 2023 at 9:00 a.m. IST and ends on Thursday, September 28, 2023 at 5:00 p.m. IST. During this period, members of the Company, holding shares as at the cut-off date of Friday, September 22, 2023 may cast their vote electronically. The remote e-voting module shall be disabled by NSDL thereafter. Members have the option to cast their vote on any of the resolutions issued by the remote e-voting facility either during the aforesaid voting period or during the AGM.

The members who have casted their vote by remote e-voting prior to the AGM may also attend / participate in the AGM through VC / OAVM, but shall not be entitled to cast their vote again. The detailed procedure for remote e-voting and e-voting during the AGM is provided in the Notice of AGM.

Any person holding shares in physical form and non-individual shareholders, who acquires shares of the Company and becomes member of the Company after sending of the Notice and holding shares as on the cut-off date, may obtain the Login ID and password by sending request at evoting@nsdl.com However, if he / she is already registered with NSDL for remote e-voting then he /she can use his / her existing User ID and password for casting the vote.

In case of queries or issues regarding remote e-voting or attending the AGM, please contact NSDL, 4th Floor, 'A' Wing, Trade World, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai 400013, Email ID: evoting@nsdl.com, Tel.: 022-48867000 and 022-24997000.

For Arman Financial Services Limited
Sd/-
Aalok Patel
Joint Managing Director
(DIN: 02482747)

This Notice is also available at Company's website www.armanindia.com and Corporate Announcement Section of Stock exchanges on www.bseindia.com and www.nseindia.com.

SRG HOUSING FINANCE LIMITED

(CIN: L65922RJ1999PLC015440)
321, S M Lodha Complex, Near Shastri Circle, Udaipur-313001(Rajasthan), Phone 0294-2561882 E-mail: info@srghousing.com Website: www.srghousing.com

SYMBOLIC POSSESSION NOTICE RULE 8(1) (For Immovable Property)

Whereas, the undersigned being the authorized officer of SRG Housing Finance Limited, 321, S M Lodha Complex, Near Shastri Circle, Udaipur - 313001 (Rajasthan), under the Securitization And Reconstruction of Financial Assets and Enforcement Of Security Interest Act, 2002 and in exercise of power conferred under section 13(12) read with rule 3 of Security Interest (Enforcement) Rules, 2002, issued demand notices on the dates mentioned against each account calling upon the respective borrowers/co-borrowers/mortgagors/guarantors, to repay the amount within 60 days from the date of receipt of the said notices. The borrowers/co-borrowers/mortgagors/guarantors having failed to repay the amount, notice is hereby issued to the borrowers/co-borrowers/mortgagors/guarantors and the public in general, that the undersigned has taken symbolic possession of the properties described herein below in exercise of powers conferred on him under section 13(4) of the said Act, read with rule 9 of the said rules, on the dates mentioned against each account. The borrowers/co-borrowers/mortgagors/guarantors in particular and public in general are hereby cautioned not to deal with the properties and any dealing with the properties will be subject to the charge of SRG Housing Finance Limited, 321, S M Lodha Complex, Near Shastri Circle, Udaipur - 313001 (Rajasthan), for the amounts mentioned below plus future interest and cost/charges thereon until the realization.

The Borrowers/Co-borrowers/Mortgagors/Guarantors attention are invited to the provisions of sub-section (8) of section 13 of the said Act, in respect of time available to redeem the available secured assets.

S. NO.	Loan Account Number (lan)/ Borrowers/ Co-borrowers/ Guarantors	1) Date Of Demand Notice 2) Date Of Symbolic Possession 3) Claim Amount As Per Demand Notice	Description Of Immovable Property (Together With Buildings And Structures Constructed, To Be Constructed Thereon Along With Fixtures And Fittings Attached To The Earth And Anything Attached To The Earth.)
1.	HLR0000000006361 Mr. Chamnaji Ramaji Thakor S/o Mr. Ramaji Thakor (Borrower) Mr. Ramaji Kanaji Thakor S/o Mr. Kanaji Thakor (Co-Borrower-1) Mrs. Ashaben Chamnaji Thakor W/o Mr. Chamnaji Thakor (Co-Borrower-2) Mr. Thakor Chetanji Ramaji S/o Mr. Ramaji Thakor (Co-Borrower-3) Mr. Rameshji Manaji Thakor S/o Mr. Manaji Thakor (Guarantor)	1. Date Of Demand Notice - March 24, 2023 2. Date Of Symbolic Possession - September 01, 2023 3. Claim Amount As Per Demand Notice - ₹5,37,050/- Rupees Five Lakh Thirty-seven Thousand Six Hundred And Fifty Only As On March 22, 2023 Plus Future Interest, Incidental Expenses, Cost, Charges, Etc. W.e.f. March 23, 2023	All That Piece And Parcel Of Land Owned By:- In The Name Of Mr. Ramaji Kanaji Thakor S/o Mr. Kanaji Having Plot No.- 1/a Paiki Chali Type Sub Plot No.- 18 Of Suncity Row House Which Is Situated In Survey No.- 6483 (old Survey No.- 267) Gram- Nagalpur, Tehsil- Mehlsana, District- Mehlsana (Gujarat) Having Land Area Of 29.18 Sq. Mtrs. Surrounded By:- East- Adj. Margin Land And Road, West- Adj. Plot No. 1 Paiki Sub Plot, North- Adj. Sub Plot No. 19, South- Adj. Sub Plot No. 17
2.	HLR00000000007865 Mr. Govindbhai Khemchandbhai Prajapati S/o Mr. Khemchandbhai Prajapati (Borrower) Mrs. Dipikabai Prajapati S/o Mr. Govindbhai Prajapati (Co-Borrower) Mr. Prajapati Anilbhai Gamabhai S/o Mr. Prajapati Gamabhai (Guarantor)	1. Date Of Demand Notice - September 25, 2021 2. Date Of Symbolic Possession - September 04, 2023 3. Claim Amount As Per Demand Notice - ₹4,17,220/- Rupees Four Lakh Seventeen Thousand Two Hundred And Twenty Only As On September 14, 2021, Plus Future Interest, Incidental Expenses, Cost, Charges, Etc. W.e.f. September 15, 2021.	All That Piece And Parcel Of Land Owned By:- In The Name Of Mr. Govindbhai Khemchandbhai Prajapati S/o Mr. Khemchandbhai Prajapati Having Gram Panchayat Property Assessment No.-753/3, Village- Methan, Tehsil- Sidhpur, District- Patan (Gujarat) Having Land Area Of 800 Sq. Ft. Surrounded By:- East- Road, West- Road, North- Open Space, South- House Of Mr. Umeshbhai Khemchand bhai Prajapati
3.	HLR00000000006859 Mr. Thakor Jayantiji S/o Mr. Visaji Thakor (Borrower) Mrs. Thakor Jashiben W/o Mr. Jayantiji Thakor (Co-Borrower) Mr. Dolaji Thakor S/o Mr. Ishvarji Thakor (Guarantor)	1. Date Of Demand Notice - July 06, 2021 2. Date Of Symbolic Possession - September 04, 2023 3. Claim Amount As Per Demand Notice - ₹2,57,190/- Rupees Two Lakh Fifty-seven Thousand One Hundred And Ninety Only As On June 30, 2021 Plus Future Interest, Incidental Expenses, Cost, Charges, Etc. W.e.f. July 01, 2021.	All That Piece And Parcel Of Land Owned By:- In The Name Of Mr. Jayantiji Visaji Thakor S/o Mr. Visaji Thakor Having Gram Panchayat Property Assessment No.- 558, Village- Ganthal, Tehsil- Sidhpur, District- Patan (Gujarat) Having Land Area Of 600 Sq. Ft. Surrounded By:- East- Adjoining House Of Mr. Vaghjibhai Ganjibhai Thakor, West- Adjoining House Of Mr. Ramesh bhai Amthabhai Thakor, North- Adjoining Road, South- Adjoining House Of Mr. Vanrajji Hamirji Thakor

PLACE: Udaipur
DATE: 07-09-2023

Authorized Officer
SRG Housing Finance Limited

Western Railway - Dahod

Tender Notice No. M2476LRSGR2319
Date : 01.09.2023

Name of Work : Repair, Rehabilitation, Reconditioning, Testing and supply of Tap Changer type N-32 for Electric Locos. Location: Office of CWM/ Dahod W.Rly., Estimated Cost of the work: ₹ 7,48,82,520/- Bid Security : ₹ 5,24,500/-, Date & Time of Submission & Opening of E-Tender: Submission of E-tender upto 14.30 Hrs. on 25.09.2023 and Opening of E-tender at 15.00 Hrs. on same day. Tender Notice and documents available at : www.ireps.gov.in / E-Tenders/Works/IR Electrical.

For Chief Workshop Manager
ADM/17/1/246 Western Railway, Dahod
फ़ोन नंबर : [Facebook.com/WesternRly](https://www.facebook.com/WesternRly)

WESTERN RAILWAY - VADODARA DIVISION

GATI SHAKTI DEPARTMENT

NEW TENDER NOTICE

PROVIDING DIRECT CONNECTIVITY FROM DOWN MAIN LINE

e-TENDER NOTICE NO. CPM-GSENGBRC-08R-2023-24. Sealed Tenders for and on behalf of the President of India are invited by Chief Project Manager (Gati Shakti), Western Railway, Pratanagar, Vadodara-390004 for the following works: (i) E-Tender No. CPM-GSENGBRC-08R-2023-24. (ii) Name of Work: Vadodara Division: Providing direct connectivity from Down main line to line No.6 & 7 at Vadodara Station. (iii) Approximate cost of the work (in ₹): 2,08,79,584.34. (iv) Bid Security to be deposited (in ₹): 2,54,400.00 (₹ Two Lakh Fifty Four Thousand Four Hundred only). (v) Date and time for submission of tender and opening of tender : On line tenders to be submitted on or before 15.00 Hrs. of 29.09.2023 and is to be opened on same date at 15.30 Hrs. (vi) Website particulars & Office Address where complete details can be seen: Website www.ireps.gov.in Chief Project Manager (Gati Shakti), Western Railway, Pratanagar, Vadodara-04. 168

Like us on : [Facebook.com/WesternRly](https://www.facebook.com/WesternRly)

indianexpress.com

I look at every side before taking a side.

Inform your opinion with insightful perspectives.

The Indian Express
JOURNALISM OF COURAGE

ओएनजीसी ONGC

BDA/HSE/EC/2023-24/01 WON Basin, Vadodara

NOTICE

The project exploratory drilling of 10 wells in OALP ML Block CB-NHP-type N-32 for Electric Locos. Location: Office of CWM/ Dahod W.Rly., Estimated Cost of the work: ₹ 7,48,82,520/- Bid Security : ₹ 5,24,500/-, Date & Time of Submission & Opening of E-Tender: Submission of E-tender upto 14.30 Hrs. on 25.09.2023 and Opening of E-tender at 15.00 Hrs. on same day. Tender Notice and documents available at : www.ireps.gov.in / E-Tenders/Works/IR Electrical.

For Chief Workshop Manager
ADM/17/1/246 Western Railway, Dahod
फ़ोन नंबर : [Facebook.com/WesternRly](https://www.facebook.com/WesternRly)

यूनियन बैंक Union Bank of India

एन एन सी ई आर
A Government of India Undertaking

BHUJ BRANCH : Opp. G. K. General Hospital, New Lotus Colony, Bhuj - 370 001

[Rule 8 (1)] POSSESSION NOTICE (For immovable property)

Whereas, the undersigned being the authorised officer of the Union Bank of India, Bhuj Branch : Opp. G. K. General Hospital, New Lotus Colony, Bhuj - 370 001 under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 (Act No. 54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a Demand Notice Dated 23/10/2020 calling upon the borrower Mr. Abhushan Gold, Proprietor Mr. Chintan Mahendrabhai Soni, Mortgagor Mr. Chintan Mahendrabhai Soni Guarantors Mr. Smit Mahendrabhai Soni Mrs. Jyotiben Kanaiyalal Shah & Mr. Kaniyalal Harilal Shah to repay the amount mentioned in the notice being Rs. 78,52,382.55 (Rupees Seventy Eight Lakh Fifty Two Thousand Three Hundred Eighty Two and Paise Fifty Five Only) as on 23.10.2020 with interest calculated upto 23.10.2020.

The borrower/guarantor having failed to repay the amount, notice is hereby given to the borrower/guarantor and the public in general that undersigned has Physical Possession of the property described herein below in exercise of powers conferred on him/her under sub-section 13 (4) of the said Act read with Rule 8 of the Security Interest Enforcement Rules, 2002 on 05th Day of September of the Year 2023.

The borrower/guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the Property and any dealings with the property will be subject to the charge of the Union Bank of India Bhuj Branch : Opp. G. K. General Hospital, New Lotus Colony, Bhuj - 370 001 for an amount of Rs. 78,52,382.55 (Rupees Seventy Eight Lakh Fifty Two Thousand Three Hundred Eighty Two and Paise Fifty Five Only) as on 23.10.2020 with interest calculated upto 23.10.2020.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

- Plot No. 127-135/d, adm 90.00 Sqr. Shree Swaminarayan Nagar, Revenue Survey No. 826/1 and 826/2, Bhuj - Kutch in the name of Mrs. Jyotiben Kanaiyalal Shah and Mr. Kaniyalal Harilal Harilal Shah, having Four Boundaries:
North : Sub Plot No. E East : Sub Plot No. D
South : Sub Plot No. C West : 7.50 Mtr Wide Internal Road
- Emg of Residential House in the Name of Shri Chintan Mahendrabhai Soni situated on Plot No. 405/b, admeasuring 60 Sq. Meter Built up Area 36.23 Sq. Meter Knows as Aya Nagar situated at nonagricultural Land of Bhuj Sim Revenue Survey No. 242, having Four Boundaries :
North : House on Plot No. 404/A East : Internal Road
South : House on Plot No. 405/A West : Plot No. 367 of This Land
Date : 05.09.2023 Authorised Officer,
Place : Bhuj Union Bank Of India

Government of India

Ministry of Minority Affairs

Public Notice

The Ministry of Minority Affairs in collaboration with CSC e- Governance Services Limited is organizing a special drive to re-validate the applications and verification of State Nodal Officers/District Nodal Officers/Head of Institutes/Institute Nodal Officers and applicants through Aadhaar based Biometric authentication for the scholarships of Ministry of Minority Affairs for the year 2022-23.

2. The process has been started with effect from 01.08.2023 and will be completed by 8th September, 2023. All concerned are hereby informed to ensure their bio-metric Aadhaar authentication by visiting special camps being organized at district and institute level by concerned District Level Nodal Officer and Head of Institutes respectively as per schedule provided. For further details please log on to www.https://scholarships.gov.in and alternatively may call to Helpline at 011-24364311

Sd/-
(Under Secretary, Scholarships)
SS-15/8/2022-Scholarship-MoMA

CBC-27101/11/0007/2324

KEMISTAR CORPORATION LIMITED

604, Manas Complex, Near Jodhpur Cross Road, Satellite, Ahmedabad - 380015, Gujarat.
CIN: L24233GJ1994PLC022845 Email: kemistarbase@gmail.com Web: www.kemistar.in

29TH ANNUAL GENERAL MEETING (AGM) TO BE HELD THROUGH VIDEO CONFERRING (VC)/OTHER AUDIO VISUAL MEANS (OVAM), RECORD DATE AND FINAL DIVIDEND INFORMATION

Notice is hereby given that the 29th Annual General Meeting (AGM) of the Company will be held on Friday, 29th September, 2023 at 12:00 P.M. through Video Conferencing (VC)/ Other Audio-Visual Means (OAVM) facility in compliance with the applicable provisions of the Companies Act, 2013 and the Rules made thereunder and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, read with General Circulars dated 8th April 2020, 13th April 2020, 5th May 2020, 13th January 2

YAMINI INVESTMENTS COMPANY LTD
 Regd. Off. : B-614, Crystal Plaza, opp. Infinity Mall, New Link Road, Andheri(W), Mumbai-400053
 Email ID: yaminiinvestments@gmail.com
 CIN: L67120MH1983PLC029133

NOTICE OF 40th ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING INFORMATION AND BOOK CLOSURE

The notice is hereby given that:

- The 40th Annual General Meeting ("AGM") of the Company will be held at : B-614, Crystal Plaza, opp. Infinity Mall, New Link Road, Andheri(W), Mumbai-400053 on Friday, 29th September, 2023 at 03:30 PM through video conferencing (VC) or other audio visual means ("OAVM") in compliance with all the applicable provisions of the Companies Act, 2013 ("the Act") and the Rules made thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulation") read with General Circular No. 14/2020 dated April 8, 2020 read with General Circular No. 17/2020 dated April 13, 2020 read with General Circular No. 39/2020 dated December 31, 2020, 10/2021 dated June 23, 2021 and 20/2021 dated December 8, 2021 and 3/2022 dated May 5, 2022 issued by the Ministry of Corporate Affairs, Government of India (collectively referred to as "MCA Circulars") followed by Circular issued by the SEBI (collectively referred to as "relevant circulars") to transact the Ordinary and Special Business, as set out in the Notice of AGM.
- Electronics Copies of the Notice of AGM and Annual Report for 2022-23 have been sent to all members whose email IDs are registered with the Depository Participants. The same is also available on the Company's Website- www.yaminiinvestments.co.in The dispatch of Notice of AGM has been completed on 07th September, 2023.
- Members holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date of 22nd September, 2023, may cast their vote electronically on the Ordinary and Special Business as set out in the Notice of AGM through electronics voting system of National Securities Depository Limited (NSDL), from a place other than venue of AGM (remote e-voting). All the members are informed that:
 - The Ordinary and the Special Business as set out in the Notice of AGM may be transacted through voting by electronics means;
 - The remote e-voting shall commence on Tuesday, 26th September, 2023 at 9:00 A.M. IST
 - The remote e-voting shall end on Thursday, 28th September, 2023 at 5:00 P.M. IST
 - The cut-off date for determining the eligibility to vote by electronic means or at the AGM is Friday, 22nd September, 2023.
 - Any person, who acquires shares of the Company and become member of Company after dispatch of the Notice of AGM and holding shares as of cut-off date i.e. Friday, 22nd September, 2023, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in. However, if person is already registered with NSDL for e-voting then existing user ID and password can be used for casting vote;
 - Members may note that: a) the remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the members, the member shall not be allowed to change it subsequently; b) the facility for voting through ballot paper shall be made available at the AGM; and c) the member may participate in the general meeting even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to vote again in the meeting; and d) a person whose name is recorded in the register of members or in the register of beneficial members maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting or voting at the AGM through ballot paper;
 - The Notice of AGM is available on the Company's website- www.yaminiinvestments.co.in and
 - In case of queries, members may refer to the Frequently Asked Questions (FAQs) for members and e-voting user manual for members at the Downloads Section of https://www.evoting.nsdl.com or call on toll free number 022-48867000/24997000 or at the designated email ID : evoting@nsdl.co.in, who will address the grievances connected with the electronic voting. Members may also write to the Company Secretary at the above mentioned email ID or the Registered Office address.

BOOK CLOSURE

The Register of Members and the Share Transfer books of the Company will remain closed from Friday, 22nd September, 2023 to Friday, 29th September, 2023 (both days inclusive).

By Order of the Board
 For Yamini Investments Company Ltd.
 Sd/-
 Kalpana Agarwala
 Company Secretary
 M. No: 61351

Place: Mumbai
 Date: 06th September, 2023

yaari
 Yaari Digital Integrated Services Limited
 (Formerly Yaari Digital Integrated Services Limited)
 (CIN: L10110GJ2017PTC01796)

Registered Office: 5th Floor, Plot No. 108, IT Park, Udyog Vihar, Phase 1, Gurugram - 122016, Haryana Tel: +91 124 4109501
 Website: www.yaari.com E-mail: cs.ias@indiabulls.com

NOTICE OF 16TH ANNUAL GENERAL MEETING, E-VOTING AND BOOK CLOSURE

Notice is hereby given that the 16th Annual General Meeting ("AGM") of Yaari Digital Integrated Services Limited ("the Company") is scheduled to be held on **Thursday, September 28, 2023, at 12:30 P.M.** (IST) through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") facility to transact the business as listed in the AGM Notice dated September 1, 2023, convening the AGM in compliance with all the applicable provisions of the Companies Act, 2013 ("the Act") and the Rules made thereunder and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI LODR Regulations") read with applicable circulars issued by the Ministry of Corporate Affairs ("MCA") and Securities and Exchange Board of India ("SEBI"). The proceedings of AGM shall be deemed to be conducted at the Registered Office of the Company. Members intending to attend the AGM through VC/OAVM may attend the AGM by following the procedure prescribed in the AGM Notice.

In compliance with the relevant circulars issued by MCA and SEBI, the Notice convening 16th AGM and Annual Report for the Financial Year 2022-23 ("Annual Report") has been sent, through electronic mode on September 5, 2023, to those Members whose e-mail address is registered with the Company / Registrar & Share Transfer Agent (RTA) / Depository Participants (DPs).

The aforesaid documents are also available on www.yaari.com, <https://evoting.kfintech.com>, www.bseindia.com and www.nseindia.com.

Notice is further given pursuant to Section 91 of the Act read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 (as amended) ("the Rules") and Regulation 42 of SEBI LODR Regulations, that the Register of Members and Share Transfer Books of the Company shall remain closed from Friday, September 22, 2023 to Thursday, September 28, 2023 (both days inclusive) for annual closing (for the purpose of AGM).

Pursuant to Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Rules and Regulation 44 of the SEBI LODR Regulations and applicable Circulars, the Company is providing remote e-voting facility to all its Members to exercise their right to vote on the resolutions listed in the AGM Notice and has availed the services of KFin Technologies Limited ("KFinTech") for providing VC facility and e-voting. The detailed procedure for attending the AGM through VC/OAVM and the e-voting is provided in the AGM Notice. The AGM Notice also contains Instructions/details with regard to process of obtaining Login credentials by Shareholders holding shares in physical form or in electronic form, who have not registered their e-mail address either with the Company or their respective DPs.

Some of the important details regarding the remote e-voting and VC/OAVM facility are provided below:

Link to VC	https://meetings.kfintech.com/
Link for remote e-voting	https://www.evoting.nsdl.com/
For Individual Members:	https://www.evoting.nsdl.com/ (holding securities in demat mode with NSDL) https://www.cdslindia.com/ (holding securities in demat mode with CDSL)
For Non-Individual Members and Members holding shares in physical form:	https://evoting.kfintech.com/
"Cut-off date for determining the Members entitled to vote through remote e-voting or during the AGM"	Thursday, September 21, 2023. The voting rights of Members shall be in proportion to their shares in the paid-up equity share capital of the Company, as on Thursday, September 21, 2023.
Commencement of remote e-voting period	Monday, September 25, 2023 at 10.00 A.M.
End of remote e-voting period	Wednesday, September 27, 2023 at 5.00 P.M.

The remote e-voting shall be disabled by KFinTech at 5:00 PM on September 27, 2023 and thereafter the Members shall not be able to vote through remote e-voting. However to enable the Members, who have not cast their vote through remote e-voting, insta-poll (e-voting) facility will also be made available during the AGM. Further, the Members who have cast their votes through remote e-voting may attend the AGM through VC/OAVM.

Members holding shares in physical form or those who have not registered their e-mail ID with the Company/RTA/DPs or the persons who becomes a Member of the Company after the dispatch of the AGM Notice and holds shares as on the cut-off date i.e. September 21, 2023 may obtain the User ID and password in the manner as mentioned in the Notice and can cast their vote through remote e-voting or through insta-poll (e-voting) during the meeting. Detailed instructions are provided in the AGM Notice, which is available on the website of the Company viz. www.yaari.com and also on the Website of the Stock Exchange(s) i.e. BSE Limited (BSE) and National Stock Exchange of India Limited (NSE) at www.bseindia.com and www.nseindia.com respectively and the website of RTA and KFinTech at <https://evoting.kfintech.com>.

All documents referred to in the AGM Notice and the Explanatory Statement are available on the website of the Company for Inspection by the Members.

Manner of registering/updating e-mail address:

- Members holding shares in physical mode, who have not registered/updated their e-mail address with the Company, are requested to register/update their e-mail address by submitting Form ISR-1 (available on the website of Company and RTA at <https://yaari.com>) and https://www.kfintech.com/clientservices/csr/sc_download_hrd respectively) duly filled and signed along with the supporting documents to KFin Technologies Limited, Selenium, Tower B, Plot No. 31 & 32, Financial District, Nanakramguda, Hyderabad - 500 032, Tel: +91 40 6716 2222, Toll Free No: 1-800-309-4001; E-mail id: murthy.psrch@kfintech.com or evoting@kfintech.com.
- Members holding shares in dematerialized mode, who have not registered/updated their e-mail address, are requested to register/update their e-mail address with the Depository Participant(s), where they maintain in their demat accounts.

Mr. Nishant Mittal (Membership No. 553660), Proprietor of M/s. N Mittal & Associates, Practicing Chartered Accountants, Gurugram has been appointed as Scrutinizer in accordance with the Provisions of Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 (as amended) to act as Scrutinizer for e-voting process.

In case of any query / grievance(s) connected with attending the AGM through VC/OAVM or the electronic voting, Members may refer to Mr. PSRCH Murthy, Sr. Manager - RIS, KFin Technologies Limited Unit: Yaari Digital Integrated Services Limited, Selenium Tower B, Plot 31-32, Gachibowli, Financial District, Nanakramguda, Hyderabad - 500 032, Tel: +91 40 6716 2222, Toll Free No: 1-800-309-4001; E-mail id: murthy.psrch@kfintech.com or evoting@kfintech.com.

By Order of the Board
 For Yaari Digital Integrated Services Limited
 Sd/-
 Lalit Sharma
 Company Secretary

Place: Gurugram
 Date: September 05, 2023

Saraswat Bank
સારસ્વત કો-ઓપરેટીવ બેંક લીમિટેડ
 (શિક્ષણ બેંક)

ગોળ ચોકિસ સુનિત નં. ૧૦ અને ૧૧ , શિવાલીક યા, શાર્દૂભાગ બીઆરટીએસ બસ સ્ટેન્ડ સામે, નાણપુરા -૫૦૬૪, અમદાવાદ- ૩૮૦૦૧૩. ફોન : ૯૧ ૨૭૪૬૭૯૮૫/૫૯

ઈ-દરાજુ વેચાણ નોટિસ
 (દરાજુ વેચાણ/બિડિંગ વેબસાઇટ <https://sarfaesi.auctiontigger.net> દ્વારા જ હાથ ધરવામાં આવશે)

સિક્યુરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્વેસ્ટમેન્ટ એન્ડ, ૨૦૦૨ હેલ્ડ બેંકને વસુલવામાં આવેલી સ્થાવર સંપત્તિનો વેચાણ

સારસ્વત કો-ઓપરેટીવ બેંક લીમિટેડ ના અધિકૃત અધિકારી તરીકે નીચે સહી કરેલ ૧૩(૨) હેલ્ડ જારી કરાયેલ ડિમાન્ડ નોટિસના અનુસંધાનમાં. બેંક લિ. એ સરફ્ટી સી એક્ટના ૧૩(૨) હેલ્ડ નોટિસની સંપત્તિઓનો વખતો મેળવ્યો છે. જાહેર વખતને જાણ કરવામાં આવે છે કે બેંકના લેણાંની વસુલાત માટે નીચે દર્શાવેલ કેસમાં ચાર્જ કરેલી મિલકતનું ઈ-દરાજુ (સરફ્ટી સી એક્ટ, ૨૦૦૨ હેલ્ડ) "જેમ છે ત્યાં જ છે", "જેમ તે પ્રમાણે" અને "આશ્રય વિના" સહી સ્પષ્ટ કર્યા મુજબ:

ક્રમ	કચ્છદારનું નામ, સહ કચ્છદારનું / જમીનદાર/ ગોરોદાર કાનુની વારસદાર (જો હોય તો)	એ નોટિસ તારીખ બી. કન્યા પ્રકાર/તારીખ સી. ડીમાન્ડ રકમ	મિલકતનું વર્ણન	૧. રીઝર્વ કિંમત ૨. ઈમ્પોર્ટ ૩. બીડ વધારાની રકમ
૧	કચ્છદારનું નામ કંસારા હરીવલ્લ ગોપાલદાસ કંસારા-કચ્છદારનું નામ કંસારા યેશાલી હમીરા (કંસારા હરીવલ્લ ગોપાલદાસના પત્ની) જમીનદાર - N.A. ગોરોદારનું નામ ૧. કંસારા હરીવલ્લ ગોપાલદાસ ૨. કંસારા યેશાલી હમીરા	એ તા. ૦૧-૦૮-૨૦૨૩ બી. ભૌતિક વિભાગ, તા.30-૦૭-૨૦૨૩ સી. રૂ. ૪૫,૯૦,૫૪૨.૨૨ (અંકે રૂપિયા પચાસીસ લાખ નવ હજાર પાંચસો બોલો અને બાવીસ પૈસા ચાર) તા. ૨૭-૦૮-૨૦૨૨ તેના પર વધુ વ્યાજ સાથે	રામાના ગીરો મુકેલ ડેસીડેન્સીયલ ફુલેટ ટાવર-૨, ફુલેટ નં. ૧૦૯, પહેલા માળે, મોલાવીસા, જુનો મેદા મોર મોલ પાસે, માંજલપુર, વડોદરા-૩૮૦૦૧૫ (લેખકળ ૮૮૫ ચો. ફુટ બિંદુ અપ)	૧. ૫૦.૨૦ લાખ ૨. ૧૨.૫૫ લાખ ૩. ૦.૫૦ લાખ ૨૯-૦૯-૨૦૨૩ નાપોટે ૩-૦૦ થી ૫-૦૦ સુધી ૦૯-૧૦-૨૦૨૩ નાપોટે ૫-૦૦ વાગ્યા સુધી ૧૦-૧૦-૨૦૨૩ નાપોટે ૨-૦૦ થી ૪-૦૦ સુધી

*યુક્તબીની તારીખ અને/અથવા વસુલાતની તારીખ સુધી લાગુ પડતાં વધુ વ્યાજ સાથે, આકસ્મિક ખર્ચ, ખર્ચ, ચાર્જ વગેરે.

દરાજુ બેંકના માધ્યમથી પ્રદાતા મેસેજ ઈ-પ્રોસેસોરનેટ ટેકનોલોજીસ લિમિટેડ (એક્સબાઇ ટાઇગર) દ્વારા હાથ ધરવામાં આવશે. બિડ ફોર્મ, ઉપરોક્ત વેચાણ/ઓક્શનના નિયમો અને શરતો અને બિડ/ઓફર સબમિટ કરવાની પ્રક્રિયા તેમની વેબસાઇટ પરથી સહી ઉપલબ્ધ છે.

સરફ્ટી સી એક્ટ, ૨૦૦૨ ના નિયમ ૮(૬) મુજબ કાનુની નોટિસ

આ નોટિસને ઉદાર લેનારા/ઓ, સહ-ઉદાર લેનારાઓ, ઉક્ત લોનના બાંધકરી આપનારાઓ અને ગેરોને પણ નોટિસ તરીકે ગણવામાં આવશે. વેચાણની તારીખ પહેલાં સંપૂર્ણ લેણાં ચૂકવવા, જો બિડ/ઓફર જરૂર તો ઉપરોક્ત તારીખે મિલકત વેચવામાં આવશે. દરાજુની તારીખનો ઉલ્લેખ કર્યો છે.

તારીખ : ૦૬.૦૯.૨૦૨૩
 સ્થળ : વડોદરા

અધિકૃત અધિકારી
 સારસ્વત કો-ઓપ. બેંક લી.

પંજાબ નેશનલ બેંક | Punjab national bank

APPENDIX IV [See Rule 8 (1)]
કન્યા નોટિસ (અર્થવિનિયમ મિલકત ઓફ)

આથી, નીચે સહી કરનાર **પંજાબ નેશનલ બેંક** ના અધિકૃત અધિકારીએ સિક્યુરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્વેસ્ટમેન્ટ એન્ડ, ૨૦૦૨ ની ધારા ૧૩(૨) સાથે વંચતા નિયમ ૩ હેલ્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટમેન્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના અંતર્ગત નીચે દર્શાવેલ તારીખે ડિમાન્ડ નોટિસ જારી કરેલ હતી જેમાં કચ્છદાર/ જમીનદાર/ ગોરોદારને નોટિસમાં જણાવેલ રકમ તેની સાથે પૂરેપૂરી રકમ ન ચૂકવવા ત્યાં સુધી યુક્ત વ્યાજ, આશ્રય ખર્ચ, કોસ્ટ, ચાર્જિંગ વગેરે સાથે સરદર નોટિસ પ્રાપ્ત થવાની તારીખથી ૬૦ દિવસોમાં ચૂકવવા જણાવવામાં આવ્યું હતું.

કચ્છદાર/ જમીનદાર/ ગોરોદાર આ રકમ ચૂકવવામાં અસક્ષમ રહેલ છે. આથી કચ્છદાર/ જમીનદાર/ ગોરોદારને જાહેર જનતાને જણાવવામાં આવે છે કે તા. ૦૨.૦૯.૨૦૨૩ ના રોજ સિક્યુરિટી ઇન્વેસ્ટમેન્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ અંતર્ગત નિયમ ૮ ના ધારા ૧૩(૨) ના અંતર્ગત નીચે દર્શાવેલ અધિકારીએ પોતાના અધિકારથી નીચે દર્શાવેલ મિલકતોનો કબજો મેળવેલ છે.

ગરિબ રાખેલ અસહાયતાનો અપેલા સમયમાં ઓકાવવા અને કચ્છદાર/ ગોરોદાર/ જમીનદારનું સરફ્ટી કાગદા સેવાના ૧૩ ના સબ-સેશન (૮) ની જોગવાઈ તક ધ્યાન રોજવામાં આવી છે.

કચ્છદાર/ ગોરોદાર/ જમીનદારને વિશેષરૂપે અને જાહેર જનતાને સામાન્ય રીતે અહીંથી તેવણી આપવાની કે નીચે દર્શાવેલ મિલકત ઓફ ડી વ્યવહાર સ્વયં નહીં અને મિલકત ઓફ ડી વ્યવહાર સ્વયં પંજાબ નેશનલ બેંકની બાકી રકમ અને પૂરેપૂરી રકમ ન ચૂકવવા ત્યાં સુધી યુક્ત વ્યાજ અને ખર્ચ સાથેની રકમનો બોજોને આધિન રાખેલું છે.

ક્ર. નં.	કચ્છદાર/ જમીનદાર/ ગોરોદારનું નામ	તારીખ: ૧૫.૦૯.૨૦૨૩	ડિમાન્ડ નોટિસ તારીખ અને બાકી રકમ
૧	શ્રી ગણપત મહાલિાલ મકવાલા અને શ્રી શાંતિલાલ મહાલિાલ મકવાલા	તારીખ: ૧૫.૦૯.૨૦૨૩ ગા. ૦૬.૧૬.૧૫૫.૩૯ તારીખ ૧૩.૦૯.૨૦૨૩ સુધીના	

નિકલતની વિગતો: કચ્છદાર નં. એલ.એલ. - ૨/ બી-૨૦૬, સર્વે નં. ૧૫૪૪, ૩૩૩૨ એલ.એલ.ઈ. - ૨, પાંડિત દીપા દલાલ અને, તિલોટી રોડ, મહેસાણા. લેખકળ ૪૫૦.૦૦ ચો. ફુટ. મોટરડી ની રહેણાંક મિલકતના બધા ભાગ અને હિસ્સા સાથે શ્રી ગણપત મહાલિાલ મકવાલાની માલિકી.

સુચરણીયા: પૂર્વ: માર્શુન ખૂદી જગ્યા, પશ્ચિમ: ફલેટ નં. ૨૦૫, ઉત્તર: માર્શુન ખૂદી જગ્યા, દક્ષિણ: પેસેજ / ફલેટ નં. ૨૦૭

ક્ર. નં.	કચ્છદાર/ જમીનદાર/ ગોરોદારનું નામ	તારીખ: ૧૫.૦૯.૨૦૨૩	ડિમાન્ડ નોટિસ તારીખ અને બાકી રકમ
૨	શ્રી ત્રિભાગિણી પોલાજી મેદાતિયા અને આશીશકુમાર ગોવિંદભાઈ આર્બ	તારીખ: ૧૫.૦૯.૨૦૨૩ ગા. ૦૨.૦૩.૯૫૪.૪૦ તારીખ ૧૩.૦૯.૨૦૨૩ સુધીના	

નિકલતની વિગતો: (જમીન અને બિલ્ડિંગ) બાંધકામ થયેલ / થનારા મિલકત એસોસિએટ્ડ રજીસ્ટર્ડ ઓફિસ મિલકત કોમર્સિયલ ડેકાન નં. એલ.એલ. - ૫, લોવર લેવેલ બાંધકામ ઓફ સીટી સર્વે નં. ૨૮૮ પૈકી બાંધકામ શરૂઆત અંદાજે ૮-૩૬૦ ફે. મોટરડી ન્યુ બજાર, "ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોમ્પ્લેક્સ" નામે જાણીતું, હિંમતનગર હિંમતનગર નગરપાલિકાની સીમા.

સુચરણીયા: પૂર્વ: ફાલન નં. એલ.એલ. - ૭ પ્લાનમાં દર્શાવ્યા મુજબ, પશ્ચિમ: ફાલન નં. એલ.એલ. - ૭ પ્લાનમાં દર્શાવ્યા મુજબ, ઉત્તર: કોલન પેસેજ પ્લાનમાં દર્શાવ્યા મુજબ, દક્ષિણ: ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોમ્પ્લેક્સ ની મિલકત પ્લાનમાં દર્શાવ્યા મુજબ

તારીખ : ૦૨.૦૯.૨૦૨૩
 સ્થળ : મહેસાણા અને હિંમતનગર

અધિકૃત અધિકારી
 પંજાબ નેશનલ બેંક

અંગેજી અને ગુજરાતી જાહેરાતમાં તાવત હોત તે કાગદાકીય બનાવો માટે અંગેજી જાહેરાત માલ્ય ગણાશે.

અતુલ ઓટો લિમિટેડ
 (CIN: L54100GJ1986PLC016999)
 રજી. ઓફિસ : સર્વે નં. ૮૨, પ્લોટ નં. ૧-૧, ૮-બી, નેશનલ હાઇવે, મહીસોલ પાસે પાસા, (જી. રાજકોટ), જી. રાજકોટ, ગુજરાત ૩૬૦ ૦૨૪
 ફોન : ૦૨૨૨૨ ૨૩૫૧૦૦, ઈ-મેઇલ : investorrelations@atulauto.co.in

૩૫ મી વાર્ષિક સાધારણ સભા તથા બુક ક્લોઝર નોટિસ અને ઈ-વોટિંગ વિશે માહિતી

આથી નોટિસ આપવામાં આવે છે કે અતુલ ઓટો લિમિટેડના સભ્યોની ૩૫મી વાર્ષિક સાધારણ સભા યોજાવા, સપ્ટેમ્બર ૨૦, ૨૦૨૩ના રોજ બપોરે ૦૨:૦૦ કલાકે (IST) બિડિંગ કોમ્પ્યુટરિંગ (વીસી) / અલ્ટ્રા ઓડિયો-વિડિયો (ઓઆઈ) માધ્યમ (ઓએવીએમ) દ્વારા યોજાશે. સભ્યોની કોર્પોરેટ હાજરી સાથે કોઈ એક સ્થળે એકઠા થઈને સાધારણ સભા કરવાનું યોગ્ય છે. જે કંપની ધારા ૨૦૨૩ અને બિલ્ડિંગ ઓફ ગોવર્નિંગ અંદરના પરિપત્ર ના. ૮ એમિલિ.૨૦૨૨, ના. ૧૩ એમિલિ.૨૦૨૨, ના. ૧૩ અલ્ટ્રા.૨૦૨૧, ના. ૨૮ ડિસેમ્બર, ૨૦૨૨ તથા સેબીના ૧૧ મે, ૨૦૨૨ અને તા. ૫ જાન્યુઆરી, ૨૦૨૩ના પરિપત્ર ("પરિપત્ર") દ્વારા માલ્ય છે.

ઉપરના પરિપત્રોને ધ્યાનમાં રાખીને, જે સભ્યોનું ઈ-વોટિંગ એક્સેસ કોડ/ ડિપોઝિટરી પાસે મોકલવા હોય, કસ્ટ તેમજ સભ્યોને જ સાધારણ સભાની નોટિસ અને બાંધકામ સભા દરમિયાન ૨૦૨૨-૨૩ ઈલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા મોકલવા છે. સાધારણ સભાની નોટિસ અને બાંધકામ સભા ૨૦૨૨-૨૩ તા. ૬ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ ઈ-મેઇલ મારફતે કંપનીના સભ્યોને મોકલી દેવામાં છે. આ નોટિસ અને અહેવાલ કંપનીની વેબસાઇટ www.atulauto.co.in/annual-reports.aspx બિલ્ડિંગ ઓફ ગોવર્નિંગ અને નેશનલ સેકેન્ડ એક્સચેન્જની વેબસાઇટ www.bseindia.com તથા www.nseindia.com અને એન્ફોર્સમેન્ટની વેબસાઇટ www.evoting.nsdl.com પર પણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

કંપની ધારા, ૨૦૧૩ની કલમ-૧૦૮ તેમજ તે કલમના નિયમો અને સેબી રેગ્યુલેશનના ૪૪મી રેગ્યુલેશન મુજબ કંપનીએ તેના સભ્યોને ઈ-વોટિંગ તેમજ સાધારણ સભા દરમિયાન ઈ-વોટિંગ ક્લાસી સંપાદન આપેલ છે. આ ઈ-વોટિંગની સુવિધા એન્ફોર્સમેન્ટની ઈ-વોટિંગ પ્લેટફોર્મ દ્વારા આપવામાં આવશે. આથી યુક્ત સભ્યોને જણાવવાનું છે :

- ૩૫મી સાધારણ સભાની નોટિસમાં સમાવવાના તમામ ઘટના પર ઈલેક્ટ્રોનિક માધ્યમથી વોટિંગ થઈ શકશે.
- રિમોટ ઈ-વોટિંગની સુવિધા તા. ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ સવારે ૯ કલાકથી શરૂ થશે અને તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ સાંજે ૫ કલાક સુધી પૂર્ણ થશે. ઉપરોક્ત તારીખ અને સમય માટેના પછી રિમોટ ઈ-વોટિંગ થઈ શકશે નહીં.
- ઈ-વોટિંગ અને સાધારણ સભામાં મત આપવા માટેની ઓનલાઇન ઘડવાના સમયે નક્કી કરવાની તારીખ ("કટ-ઓફ ડેટ") ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૩ રિમોટ ઈ-વોટિંગ દરમિયાન છે.
- જે વ્યક્તિ સાધારણ સભાની નોટિસ મોકલવા પછી અને કટ-ઓફ ડેટ, ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીના સમય હોય તેમણે તેમણે એન્ફોર્સમેન્ટને મારફતે ઈ-વોટિંગ સભાના યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવા evoting@nsdl.co.in પર ઈ-મેઇલ દ્વારા અરજી કરી અથવા તો નેશનલ સેકેન્ડ એક્સચેન્જના ૦૨૨ ૨૮૬૬૦૦૦૦ પર ફોન કરીને મેળવી શકશે અને સાધારણ સભાની નોટિસમાં અને એન્ફોર્સમેન્ટની ઈ-વોટિંગ પ્લેટફોર્મની વેબસાઇટ www.evoting.nsdl.com પર આપવામાં આવેલ વિગતવાર કાર્યવાહી અને સૂચનાઓનું પાલન કરીને મત આપી શકે છે.
- ઈ-વોટિંગને લગતા કોઈપણ પ્રશ્નો માટે સભ્યો/બેનિફિસીયલ ઓનર વારંવાર પૂછતા પ્રશ્ન (FAQ) અને ઈ-વોટિંગ યુઝર નેચ્યુઅલનો સર્વેલ લઈ શકે છે. જે એન્ફોર્સમેન્ટની ઈ-વોટિંગ પ્લેટફોર્મની વેબસાઇટ www.evoting.nsdl.com પર ઉપલબ્ધ છે અથવા તો ઉપર જણાવેલ નંબર પર ફોન કરી શકે છે અથવા કેન્ટ્રલિઝમ પેલ પ્રબંધક, એન્ફોર્સમેન્ટને evoting@nsdl.co.in પર ઈ-મેઇલ મારફતે સંપર્ક કરી શકે છે અથવા નીચે સહી કરનાર વ્યક્તિનો ઉપર જણાવેલ ફોન નંબર, ઈ-મેઇલ કે સમાન્ય સંપર્ક કરવો, જે રિમોટ ઈ-વોટિંગને લગતા તમામ પ્રશ્નો કે ફરિયાદોના નિવારણ માટે જવાબદાર વ્યક્તિ છે.
- તમામ સભ્યોએ નોંધ લેવી કે :
 - કોઈપણ ઘટના પર એક વખત ઈ-વોટ કરી દીધા પછી તેને ફેરફાર થઈ શકશે નહીં.
 - જે સભ્યોએ રિમોટ ઈ-વોટિંગ કરેલ નથી, તે સભ્યો સાધારણ સભા દરમિયાન ઈ-વોટિંગ દ્વારા મત આપી શકશે.
 - જે સભ્યોએ રિમોટ ઈ-વોટિંગ કરેલ છે, તે સાધારણ સભામાં વીસી/ઓએવીએમ મારફતે મત લઈ શકશે, પણ મત આપી શકશે નહીં.
 - કટ-ઓફ ડેટના રોજ કંપનીના રિજિસ્ટર્ડ સભ્ય હોય અથવા તો કોર્પોરેટીઝના રજિસ્ટર્ડ બેનિફિસીયલ ઓનર હોય તે જ વ્યક્તિઓ રિમોટ ઈ-વોટિંગ કે સાધારણ સભામાં ઈ-વોટિંગ દ્વારા મત આપવાની પાત્રતા ધરાવે છે.
- જે સભ્યોએ પોતાના ઈ-મેઇલ કંપની/ ડિપોઝિટરી પાર્ટીસીપન્ટ પાસે નોંધાવેલ ના હોય તેમણે નોટિસમાં જણાવ્યા મુજબ નોંધાવી લેવા. કંપનીના સભ્યો કે જો કોઈને કે ડિપોઝિટરી માં ચોર ઘડવો છે કે પછી ઈ-મેઇલ નોંધાવેલ નથી તે તમામ નોટિસ ઈ-વોટિંગ તથા સાધારણ સભા દરમિયાન ઈ-વોટિંગ કરી શકે તેવી માહિતી નોટિસમાં આપેલ છે.
- કંપની ધારા, ૨૦૧૩ની કલમ-૮૧ તેમજ તે કલમના નિયમો અને સેબી રેગ્યુલેશનના ૪૨મી રેગ્યુલેશન મુજબ, ૩૫મી સાધારણ સભાના સુધારક કંપનીના સભ્યો અને ચોર ફેરફારના રજિસ્ટર તા. ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૩ થી લઈને તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ (બંને દિવસો સહિત) બંધ રહેશે.

અતુલ ઓટો લિમિટેડ વતી,
 (પારસ જે. વિરમગામી)
 ચાપર (જી. રાજકોટ)
 ૦૬ સપ્ટેમ્બર ૨૦૨૩

કંપની સેક્રેટરી & કમ્પલાયન્સ ઓફિ